

ઈ-મેઇલ મેસેજ

પ્રતિ :- ડાયરેક્ટરશ્રી, ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લી., ગાંધીનગર (gujinfo.gog@gmail.com)

જાણ :- (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા., ગાંધીનગર

(૨) અધિક પોલીસ મહાનિદેશક અને કમિશ્નરશ્રી તકનીકી સેવા, ગુ.રા., ગાંધીનગર

(gswan-conn@gujarat.gov.in)

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, જૂનાગઢ વિભાગ, જૂનાગઢ

પ્રેષક :- પોલીસ અધિક્ષક, પોરબંદર.

નંબર :- કોમ્પ્યુટર/વેબસાઇટ અપલોડ/૧૬૬/૨૦૨૨, તા.૨૮/૦૩/૨૦૨૨

વિગત :-

સવિનય આપશ્રીની કચેરીના જીસ્વાન મેસેજ નં. જી૧(કાઇમ)/ટે-૨/સારી કામગીરી/૧૭૮૧/૨૦૧૨, તા.૧૭/૦૫/૨૦૧૨ તથા ગૃહ વિભાગ ગાંધીનગરના નં. આઇટી/ ૧૦૨૦૧૧/૩૦/આઇટી સેલ/૨૦૧૨ તા.૧૨/૦૭/૨૦૧૨ અન્વયે પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૫:- વૃધ્ધો મહીલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્ટ કામગીરી :-

(૧) તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૭/૦૩/૨૦૨૨ દરમિયાન જાવર ગામ વિસ્તારમાં મોડી રાત્રીના મજૂરી પર થી ઘરે જતી મહીલાઓને સી-ટીમ તથા ડાયલ ૧૦૦ નંબર તથા ૧૮૧ વિશે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ અને કોઈ તકલીફ કે મુશ્કેલી હોય તો સી-ટીમ તથા ડાયલ ૧૦૦ નંબર તથા ૧૮૧ માં જાણ કરવા સમજ કરેલ. તેમજ કુછડી ગામે સીનીયર સિટીઝનની મુલાકાત લેવામાં આવેલ.

મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતની બાબતો જે લોકોને તુરંત જ ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧) તા.૨૩/૦૩/૨૦૨૨ ના રોજ પોરબંદર સુદામા ચોક વિસ્તારમાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો જીજ્ઞેશ જીવાભાઇ ભુવા રહે, ખાપટ ગામ, રાતડા સીમ શાળાની બાજુમાં પોરબંદરનો વિવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૩૯૯૯/- નો સુદામા ચોક વિસ્તારમાંથી ગુમ થયા અંગેની રજુઆત કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં કરતા આ મોબાઇલ વિશે નેત્રમ પ્રોજેક્ટના કમાન્ડ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ PSI શ્રી પી.આર.પટેલ સાહેબ તથા તેમની ટીમની મદદથી સદરહુ મોબાઇલ ફોન હનુમાનગુફા પોલીસ ચોકીના PSI શ્રી બી.એસ.ઝાલા સાહેબ તથા HC એસ.એ.બકોત્રા તથા સી-ટીમના કર્મચારી PC દક્ષાબેન મંગાભાઇ તથા ડ્રા.PC હિરેન રતિલાલ દ્વારા સઘન તપાસ કરી મોબાઇલ શોધી કાઢેલ છે અને મોબાઇલ મુળ માલીક રિક્ષા ચાલક જીજ્ઞેશભાઇને પરત સોપેલ છે.

(૨) તા.૨૧/૦૩/૨૨ થી તા.૨૭/૦૩/૨૨ સુધી હાર્બર મરીન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ૩૫ માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરવા તથા સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ કોરોના વાયરસની મહામારીથી બચવા જરૂરી તકેદારી તેમજ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબનાં નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવેલ.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર